

RAN-2308000601030001 / 2608006601030001
F.Y.B.Com. (Sem. II) Examination April - 2026
Economics : Minor - Business - Economics
Time: 2 Hours]
[Total Marks: 50

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book.	Seat No.: <table border="1"> <tr> <td></td><td></td><td></td><td></td><td></td><td></td> </tr> </table> Student's Signature						

- પ્ર. 1 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. (કોઈ પણ પાંચ) (10)**
- ધંધાકીય અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો.
 - અર્થતંત્રની મૂળભૂત આર્થિક સમસ્યાઓ કઈ છે?
 - માંગ આગાહીની સારી પદ્ધતિનાં ધોરણો જણાવો.
 - પેટ્રોની માંગ અને ઉદ્યોગની માંગ વચ્ચેનો તફાવત જણાવો.
 - આંતરિક કદનાં ગેરલાભના ફક્ત નામ જણાવો.
 - એક્સપોર્ટીંગ ખર્ચ અને આર્થિક ખર્ચ વચ્ચેનો તફાવત આપો.
 - સીમાંત ખર્ચ એટલે શું?
- પ્ર. 2 માંગની મૂલ્યસાપેક્ષતા એટલે શું? માંગની મૂલ્યસાપેક્ષતાનાં પ્રકારો આકૃતિની મદદથી સમજાવો. (14)**
- અથવા**
- પ્ર. 2 (અ) વટાવનો સિદ્ધાંત સમજાવો. (7)**
- (બ) ધંધાકીય અર્થશાસ્ત્રનાં લક્ષણોની ચર્ચા કરો. (7)**
- પ્ર. 3 ટૂંકગાળામાં ખર્ચ અને ઉત્પાદન વચ્ચેનાં આંતરસંબંધો આકૃતિની મદદથી સમજાવો. (14)**
- અથવા**
- પ્ર. 3 (અ) બિનપ્રમાણસર ઉત્પાદનનો નિયમ સમજાવો. (7)**
- (બ) પૂરવઠાનો નિયમ સમજાવો. (7)**
- પ્ર. 4 ટૂંક નોંધ લખો. (કોઈ પણ બે) (12)**
- વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ
 - માંગના નિર્ણાયક પરિબળો
 - ઉત્પાદન વિધેય
 - પૂર્ણ હરિકાઈ અને ઈજારામાં સરેરાશ આવક અને સીમાંત આવક રેખા .

ENGLISH VERSION

- Q. 1** **Answer the following questions in brief. (Any five)** **(10)**
1. Give the definition of business economics.
 2. Which are the basic problems of an economy?
 3. State the criteria of a good forecasting method.
 4. State the difference between company demand and Industry demand.
 5. Simply the name of internal diseconomies of scale.
 6. Give the difference between accounting cost and economic cost.
 7. What is meant by marginal cost?
- Q. 2** What is price elasticity of demand? Explain the types of price elasticity of demand with the help of diagram. **(14)**
- OR**
- Q. 2 (A)** Explain the discounting principle. **(7)**
- (B)** Discuss the characteristics of business economics. **(7)**
- Q. 3** Explain the inter-relationship between cost and output in short run with the help of diagram. **(14)**
- OR**
- Q. 3 (A)** Explain the law of variable proportion. **(7)**
- (B)** Explain the law of supply. **(7)**
- Q. 4** **Write short notes. (Any Two)** **(12)**
1. Concept of opportunity cost
 2. Determinants of demand
 3. Production function
 4. Average revenue and marginal revenue curves in perfect competition and monopoly.
-